

૨૧ મોબાઇલ ફોન ઉપર સદ્દાનું વલણ લેતાં પાંચ સટોડિયાને ઝડપી લેવાયા.

- પાલનપુરના રાજહંસ એપલમાં કાઇમ બ્રાંચનો દરોડો. બુકી ભરત ઠક્કર વોન્ટેડ જાહેર કરાયો.
- ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝ વચ્ચેની વન ડે મેચ ઉપર સદ્દા રમાડતા હતા. તા.૧૦/૦૩/૨૦૧૭

પાલનપુર કેનાલ રોડ ઉપર આવેલા રાજહંસ એપલ એપાર્ટમેન્ટમાં ગુરૂવારે મોડી રાતે પોલીસે દરોડો પાડી ક્રિકેટ મેચ ઉપર સદ્દા રમાડવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝ વચ્ચેની વન ડે મેચ ઉપર સદ્દા રમાડતા પાંચ યુવકોને પકડી પોલીસે ૨.૭૮ લાખ કિંમતની મતા કબજે લીધી હતી.

કાઇમ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઇન્સ્પેક્ટર અનિરૂઘ્ધ કેપ્ટનની સુચનાથી સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. ત્રિવેદી તેમની ટીમ સાથે જુગાર તથા સદ્દાના ગોરખ ધંધા અંગે માહિતી મેળવી કાર્યવાહી માટે ખાનગી બાતમીદારોને કામે લગાવ્યા છે. આ દરમિયાન કોન્સ્ટેબલ પંકજસિંહને એવી બાતમી મળી હતી. પાલનપુર ગામ કેનાલ રોડ ઉપર આવેલા રાજહંસ એપલ એપાર્ટમેન્ટમાંથી ક્રિકેટના સદ્દાનું રેકેટ ઓપરેટ કરાઇ રહ્યું છે.

ત્રિવેદી તેમની ટીમ સાથે આ બાતમી અંગે વિસ્તૃત માહિતી એકત્ર કર્યા બાદ ગુરૂવારે રાતે ત્યાં દરોડો પાડ્યો હતો. ચોથા માળે આવેલા ફ્લેટમાંથી પોલીસે જીતેન્દ્ર જેરામભાઈ ખત્રી રોહિત ઠાકોરદાસ મખીજા (રહે.મંગલ પુષ્પ એપાર્ટમેન્ટ, સીટીઝન સ્કુલ સામે, અડાજણ), અજય શુભકરણ જૈન (રહે. રાજ રેસીડેન્સી, પરવટ પાટીયા), મુકેશ મોતીભાઈ કેશવાની (રહે. સંત તુકારામ સોસાયટી, પાલનપુર જકાતનાકા) તથા શાંતુ ગણેશ બાલા (રહે. રાજહંસ એપલ, પાલનપુર કેનાલ રોડ)ને ઝડપી લીધા હતા. આ ચાર યુવકો ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાઇ રહેલી વન ડે ક્રિકેટ મેચ ઉપર વલણ લેતા હતા.

પોલીસે આ પાંચ યુવકો પાસેથી બે લેપટોપ એક ટેલીવિઝન, ૨૧ મોબાઇલ ફોન, રોકડા ૩૧,૮૦૦/- મળી ફૂલ ૨,૭૮,૮૦૦/- કિંમતની મતા કબજે લીધી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ પન્ટરો ભરત ઠક્કર ઉર્ફે કલ્યાણને વલણ કપાવતા હતા. પોલીસે ભરત ઠક્કરને વોન્ટેડ જાહેર કરી ચારેય સામે જુગારધારા અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં શરૂ થતી આઇપીએલ પર પણ પોલીસની નજર છે.